

જાણકાઈ સંસ્થાઓ સાથે કોલેજોમાં વપરાશમાં લેવાની કોલેજો કેરજ
શુભ બસને માંસિક કરગુઠિત આપવાનું રાજ્ય સરકારશ્રીનું નક્કર નામુ.

6/4
35 11/10

NOTIFICATION

Ports and Transport Department
Sachivalaya, Gandhinagar
Date : 16 May, 2005

MEMORY
MOTOR
VEHICLES
TAX ACT
1958

No. GG / 2006 / 15 / MTA 1702 / 3052 / PARTFILE / Kh:-In

exercise of the powers conferred by sub-section (2) of section 13 of the Bombay Motor Vehicles Tax Act 1958 (Bom. I XV of 1958) (hereinafter referred as "the said Act") read with sub rule (1) of the rule 16-A of the Bombay Motor Vehicles Tax Rules 1959, the Government of Gujarat hereby partially exempts the contract carriage omnibuses used or kept for use solely for the purpose of transporting students of educational institutions in the State in connection with any of the activities of such educational institutions, from the payment of tax to the extent of the excess amount of tax of Rs.500/- for every passanger to be carried.

Provided that the owner or any person having possession or control of contract carriage omnibuses used or kept for use solely for the purpose of transporting students of educational Institutions in the State, shall pay the tax in advance at the rates fixed by sub-section (2) of section 9 of the Bombay Motor, Vehicles Tax (Gujarat Amendment and Validation) Act, 2002, but not exceeding the maximum rates specified in the clause IV-AAA of Part-I of FIRST SCHEDULE of the said Act.

Provided further that the owner or any person having possession or control of contract carriage omnibuses used

7/c
56
H 2 //

or kept for use solely for the purpose of transporting students of educational institutions in the State shall produce the certificate to the effect that such vehicle is used or kept for use solely for the purpose of transporting students of educational institutions in the State, of the concerned educational institution, for the period for which such vehicles is used or kept for use.

Provided also that on production of the certificate of use of such vehicle solely for the purpose of transporting students of educational institutions in the State by the owner or any person having possession or control of contract carriage omnibuses the taxation authority shall refund the excess tax paid by the owner or the person having possession or control of contract carriage omnibuses used or kept for use solely for the purpose of transporting students of educational institutions in the State.

By order and in the name of the Governor of Gujarat.

(V.M.CHAUHAN)
Joint Secretary of Government

9/6

શૈક્ષણિક હેતુ માટે વપરાશ" એવા શબ્દો કચેરી તરફથી સ્પષ્ટ રીતે લખવાનાં રહેશે.

૪. આ જાહેરનામાનો લાભ મેળવવા ઈચ્છનાર વ્યક્તિએ ઉક્ત રીતે મોટર વાહન કર ભરતી થપ્પા જે સમયગાળો " એટી " માં દર્શાવેલ હોય, તે સમયગાળા બાદ રીફંડ મેળવવા ફોર્મ " ડીટી " માં અરજી કરી શકશે. જે સાથે નીચે મુજબનાં દસ્તાવેજો જોડવાનાં રહેશે.

:એ: એડવાન્સમાં ટેક્ ભર્યા અંગેની" માત્ર શૈક્ષણિક હેતુ માટે વપરાશ "એન્ડોર્સ થયેલી રસીદ.

:બી: જે શૈક્ષણિક સંસ્થા સાથે કરાર હોય તે કરારની પ્રમાણીત નકલ

:સી: જે શૈક્ષણિક સંસ્થા સાથે કરાર હોય તે સંસ્થાના લેટરપેડ પર તે આ બસ અગાઉથી જણાવાયેલા સમયગાળા માટે તેજ સંસ્થાના શૈક્ષણિક હેતુ માટે વપરાયેલ છે અને તે સિવાય તેનો વપરાશ થયેલ નથી તેવું તે સંસ્થાનું પ્રમાણપત્ર.

:ડી: આર.સી.બુક.

(પ) આ અરજી મળ્યેથી તે ઈન્વર્ડ કરી તે અરજીની સ્વીકૃતિ પહોંચ અંરજદારને પાઠવવાની રહેશે.

(ફ) ફોર્મ "ડીટી" ઉપર ડી.એ.શાખાનો એવા મતલબનો રિમાર્ક્સ મેળવવાનો રહેશે કે " આ કોન્ટ્રાક્ટ કેરેજ બસ જે શૈક્ષણિક સંસ્થા સાથે કરારમાં છે તે સંસ્થા સિવાય અન્ય સંસ્થા કે વ્યક્તિ માટે વપરાયેલ હોવાનું જણાયેલ નથી કે આ કોન્ટ્રાક્ટ કેરેજ બસ જે શૈક્ષણિક સંસ્થા સાથે કરારમાં છે તે સંસ્થાનાં શૈક્ષણિક હેતુ સિવાય અન્ય હેતુ માટે ભાડેથી વાહન ફરતું પકડાયેલ નથી.

(ગ) ઉક્ત કાર્યવાહી કર્યા બાદ નિયમનુસાર કાર્યવાહી કીર, આ જાહેરનામું લક્ષમાં લઈ તે મુજબ કાર્યવાહી કરી અરજી મળ્યાનાં દિન-૧૫ માં રીફંડની કાર્યવાહી પુર્ણ કરવાની રહેશે.

(ઠ) રીફંડ નીચેની પદ્ધતિએ આપવાનું રહેશે.

:એ: સદર જાહેરનામાં મુજબ શૈક્ષણિક સંસ્થાઓ સાથે કરારથી જોડાયેલી અને તેજ સંસ્થાના શૈક્ષણિક હેતુ માટે ભાડેથી વપરાતી કોન્ટ્રાક્ટ કેરેજ બસ માટે આવી બસનાં વસુલ કરવાપાત્ર ટેક્ વાર્ષિક મોટર વાહન કર જો એડવાન્સમાં ભરાયેલ હોય તો પ્રતિ બેઠક દીઠ રૂ. ૫૦૦/- વાર્ષિક રીતે જમા લઈ બાકીની રકમ રીફંડને પાત્ર છે.

ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ

ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ

ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ
ପାଠ୍ୟ ପୁସ୍ତକ ବିଭାଗ, ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

$$15 \times 20 = 300$$

File 212

1912 11-21320212

1. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 2. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 3. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 4. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 5. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 6. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 7. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 8. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 9. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա
 10. Երևանի քաղաքի քաղաքապետի պաշտոնի վրա

ከ

[illegible]

2

[illegible]

6

ପ୍ରତିଟି ସାମଲରେ ଗୁଣ୍ଡା ଏବଂ କୋରାନ୍ଧନ ସାମଲ-୩
 ପ୍ରାୟ ୨୫ ମି. ମି. ପ୍ରତିଟି ପ୍ରାୟ ୧୦ ମି. ମି. ଓ ୨୫ ମି. ମି.
 ବାହ୍ୟାଂଶ ୧୦ ମି. ମି. ଓ ୧୦ ମି. ମି. ଗୁଣ୍ଡା ଓ

५

[illegible]

٦٠

217.

[illegible]

Oh,

Fig. 1